

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૦૭/૦૨/૨૦૨૧ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાબતો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

(૧) ઉદ્યોગનગર પો.સ્ટે. ગુમ જા.જોગ નં.૦૮/૨૦૨૦ તા.૦૧/૦૮/૨૦૨૦ ના રોજ ગુમ થનાર ધર્મિષ્ઠાબેન ડો/ઓ કેશવદાસ બાવાજી ઉ.વ.૨૦ રહે. ઘાસ ગોડાઉન પાછળ પોરબંદર વાળીને તા.૦૨/૦૨/૨૦૨૧ ના ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ શ્રી, કે.સી.વાઘેલાએ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :

(૧) કીર્તીમંદીર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૮૦૦૬૨૧૦૦૯૪/૨૦૨૧ IPC કલમ ૩૭૯, ૪૪૭ મુજબ કોઈ અજાણ્યા ચોર ઇસમે સુદામા ચોક બંગડી બજારમાં લીબર્ટી સોપીંગ સેન્ટરમાં પ્રવેશ કરી અગાસી ઉપર રહેલ એરટેલ કંપનીના મોબાઇલ ટાવરનો બેટરીબેંકનો ૭૫MM નો કોપરનો આશરે ૮ મીટર તથા પાવર કેબલ કોપરનો આશરે ૫ મીટર જેટલો કેબલ (વાયર) જેની આશરે કિ.રૂ.૬૦૦૦/- નો કાપી ચોરીનો બનાવ બનેલ. સદરહુ કામના આરોપી નં.(૧) બીરજુ દેવસીંગ ચૌહાણ ઉ.વ.૩૨ જાતે-બાવરી (બાવાજી) ધંધો-મજુરી રહે. કર્લીપુલ રીવરફ્રન્ટ પાસે ઝુપડપટ્ટીમાં પોરબંદર તથા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર બે (૧) અરૂણ કીશોરભાઈ વાઘેલા જાતે-દેવીપુજક ઉ.વ.૧૫ વર્ષ ૧૦ માસ ૧૮ દિવસ રહે.કર્લીપુલ રીવરફ્રન્ટ ની બાજુમાં ઝુપડામાં પોરબંદર તથા (૨) દિપસીંગ બીરસીંગ વઢીયાર ઉ.વ.૧૫ વર્ષ ૮ માસ ૧ દિવસ જાતે-બાવરી બાવાજી રહે.કર્લીપુલ રીવરફ્રન્ટ ની બાજુમાં ઝુપડામાં પોરબંદર મુજબના આરોપીને તાબાના વાયર સાથે કીર્તીમંદીર પો.સ્ટે.નાં પો.ઇન્સ.શ્રી એચ.એલ.આહિર તથા પો.સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

(૨) કીર્તીમંદીર પોલીસ સ્ટેશન સ્ટે.ડા એન્ટ્રી નં.૩૧/૨૦૨૧ તા.૦૩/૦૨/૨૦૨૧ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ચે.કે.નં.૦૧/૨૦૨૧ જી.પી.એક્ટ.૧૨૪ મુજબ કીર્તીમંદીર પો.સ્ટેના PI એચ.એલ.આહીર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે આગામી નગરપાલીકા ચુંટણી-૨૦૨૧ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લીમડા ચોક શાકમાર્કેટ પાસે રોડ ઉપર થી બે ઇસમો પાસેથી બીલ વગરના મોબાઇલ ફોન હોય જેથી બીલો રજુ કરવા જણાવતા તથા માલિક બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય અને ગોળગોળ ફરતા ફરતા જવાબો આપતા હોય જેથી પોકેટકોપ/ઈ-ગુજકોપની મદદથી આરોપીનો પૂર્વ ઇતિહાસ જાણી અને કામગીરી કરેલ સદરહુ ઇસમ (૧) ચંદાભાઈ મગનભાઈ પરમાર જાતે બાવરી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે.ચોપાટી રોડ કુટપાથ ઉપર મુળ રહે.હાપા ગામ ખાળી વિસ્તાર તા.જી.જામનગરવાળા પાસેથી કુલ-૨ મોબાઇલો પૈકી એક મોબાઇલ જોતા કાળા કલરનો VIVO કંપનીનો મોડેલ નં.1908 તથા બીજો મોબાઇલ જોતા ગોલ્ડન કલરનો OPPO કંપનીનો મોડેલ નં.A71 મળી આવેલ તથા (૨) કિશન માલદેભાઈ પરમાર ઉ.વ.૧૯ જાતે દેવીપુજક ધંધો મજુરી રહે.કર્લીના પુલ રીવરફ્રન્ટ પાસે રોડ ઉતરતા ઝુપડપટ્ટી વિસ્તાર પોરબંદર વાળા પાસેથી કુલ-૨ મોબાઇલ જે પૈકી એક કાળા કલરનો SAMSUNG

કંપનીનો મોડેલ નં.A9 Pro તથા બીજો મોબાઇલ જોતા બ્લુ કલરનો SAMSUNG કંપનીનો મોડેલ નં.Galaxy A50 મળી આવેલ હોય જેથી સદરહુ મોબાઇલના માલિક અંગે કોઇ હકિકત જણાવેલ ન હોય તેમજ કાગળો રજુ કરેલ ન હોય જેથી મજકુર ઇસમોએ સરદહુ મોબાઇલ ફોનો છળકપટ કે ચોરી થી મેળવેલ હોવાની વ્યાજબી શંકા હોય જેથી સદરહુ મોબાઇલને CRPC કલમ ૧૦૨ મુજબ શકપડતી મિલકત તરીકે ગણી તમામ મોબાઇલની કિ.રૂ.૩૮૦૦૦/-ની ગણી કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમોને CRPC કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ મજકુર બન્ને ઇસમો વિરુદ્ધ નામાદરા કોર્ટમાં GPA ક.૧૨૪ મુજબ ફરીયાદ રજીસ્ટર કરાવેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર